



ANUPAM RASAYAN INDIA LTD.

Date: February 12, 2022

ARILSLDSTX20220212075

To, BSE Limited, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai -400001, India SCRIP CODE: 543275	To, Sr. General Manager National Stock Exchange of India Limited 'Exchange Plaza', C-1, Block-G, Bandra Kurla Complex Bandra (East), Mumbai 400051, India SYMBOL: ANURAS
--	--

Dear Sir/Madam,

Subject: Newspaper Advertisement-Information regarding postal ballot notice and e-voting of the Company.

Pursuant to Regulation 30 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI (LODR) Regulations"), we are enclosing herewith copies of newspaper advertisement published today, i.e. February 12, 2022 in Financial Express (English) and Dhabkar (Gujarati) in compliance with the Regulation 47 of SEBI (LODR) Regulations, regarding postal ballot notice and e-voting information

Copies of enclosed newspaper advertisement is also uploaded on the Company's website www.anupamrasayan.com.

We request you to kindly note the same and take into your records.

Thanking you,

Yours Faithfully,
For, Anupam Rasayan India Limited


Suchi Agarwal
Company Secretary & Compliance Officer
M.N.: A32822



Registered Office :
8110, GIDC Industrial Estate,
Sachin, SURAT-394 230
Gujarat, India.

Tel. : +91-261-2398991-95
Fax : +91-261-2398996
E-mail : office@anupamrasayan.com
Website : www.anupamrasayan.com
CIN - L24231GJ2003PLC042988

PUBLIC NOTICE
 M/s. Mudra Finance Limited ("the Company") having its Registered Office at G-12/A, First Floor, Hauz Khas, New Delhi-110016 and Corporate Office at Vipul TechSquare, Golf Course Road, Sector-43, Gurugram-122009, Haryana, had made provisional allotment of Residential/Commercial Flats in the project namely Vipul Gardens, Dharuhera, Haryana, against the Earnest Money cum booking amount, and upon signing of Company's application forms containing terms and conditions of the allotment.
 As per the records maintained by the Company, the following allottees have not paid their respective dues/instalments/interest etc. as per the terms of the provisional allotment(s), despite several reminders / written communications and as a sequel thereof, the provisional allotment of the referred unit(s) stands cancelled.

S. No.	Applicant Name	Tower	Unit	Address	Area (sq. ft.)
1	MR. ASHWANI KUMAR SHARMA MR. JAWAHAR LAL BAKSHI	4	1102	Kothi No- 117, Sector-12A, Panchkula, Haryana	1240
2	MR. GULSHAN LUTHRA	2	1001	1046, Sector-14, Gurgaon-122001	1512
3	MR. GULSHAN LUTHRA	3	602	1046, Sector-14, Gurgaon-122001	1273
4	MR. VERESH KALRA MRS. RENU KALRA	2	801	C-88, Road No-40, West Punjab Bagh, New Delhi	1512
5	MRS. RENU KALRA MR. VERESH KALRA	5	303	C-88, Road No-40, West Punjab Bagh, New Delhi.	1240
6	MR. INDU RAJ	4	104	204, Sukhdev Vihar, New Delhi-110025	1371

For and on behalf of Mudra Finance Limited
 Date : February 11, 2022
 Place : Gurugram
 Sd/-
 Director

FORM G - INVITATION FOR EXPRESSION OF INTEREST
 (Under Regulation 36A (1) of the Insolvency and Bankruptcy (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)

RELEVANT PARTICULARS

1 Name of corporate debtor	Blue Blends (India) Limited
2 Date of incorporation of corporate debtor	16 th February 1981
3 Authority under which corporate debtor is incorporated/registered	Registrar of Companies, Mumbai, Maharashtra
4 Corporate identity number / limited liability identification number of corporate debtor	L17120MH1981PLC023900
5 Address of the registered office and principal office (if any) of corporate debtor	Registered Office Address: JBF House, 2nd Floor, Old Post Office Lane, Kalkadevi Road, Mumbai-400022, Maharashtra; Other Places of Business: 1. Manufacturing Unit: Saijpur Gopalpur Pipaly 123/2 Ahmedabad - 382405, Gujarat; and 2. Office premises: 603, Sahajansand, Shahibaug Road, Ahmedabad - 380004
6 Insolvency commencement date of the Corporate Debtor	2 nd December 2021
7 Date of invitation of expression of interest	12 th February 2022
8 Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at:	Details can be sought by emailing to ip.blueblends@sankalp-ipe.com
9 Norms of ineligibility applicable under section 25A are available at:	Details can be sought by emailing to ip.blueblends@sankalp-ipe.com
10 Last date for receipt of expression of interest	27 th February 2022
11 Date of issue of provisional list of prospective resolution applicants	9 th March 2022
12 Last date for submission of objections to provisional list	14 th March 2022
13 Date of issue of final list of prospective resolution applicants	24 th March 2022
14 Date of issue of information memorandum, evaluation matrix and request for resolution plans to prospective resolution applicants	14 th March 2022
15 Manner of obtaining request for resolution plan, evaluation matrix, information memorandum and further information	By Electronic Means from ip.blueblends@sankalp-ipe.com
16 Last date for submission of resolution plans	13 th April 2022
17 Manner of submitting resolution plans to resolution professional	By Registered Post or hand delivery in sealed envelope to the address mentioned at point 21 and by sending an email to ip.blueblends@sankalp-ipe.com
18 Estimated date for submission of resolution plan to the Adjudicating Authority for approval	13 th May 2022
19 Name and registration number of the resolution professional	Mr. Vinit Gangwal IBI/PA-002/IP-N00091/2017-2018/10235
20 Name, Address and e-mail of the resolution professional, as registered with the Board	Address: Office No.503, Varun capital, CTS No.364-365/13, Off. J.M. Road, Bharat Petroleum Lane, Next to Citiotel, Shivajinagar, Pune, Maharashtra - 411005 Email: ip.vinitgangwal@sudharman.in
21 Address and email to be used for correspondence with the resolution professional	Address - 4th Floor, 401, The Central, Shell Colony Road, Chembur (East), Mumbai-400071. Email- ip.blueblends@sankalp-ipe.com
22 Further Details are available at or with	ip.blueblends@sankalp-ipe.com
23 Date of publication of Form G	12 th February 2022

Place : Mumbai
 Date : 12.02.2022
 Resolution Professional Blue Blends (India) Limited
 Address: Office No.503, Varun capital, CTS No.364-365/13, Off. J.M. Road, Bharat Petroleum Lane, Next to Citiotel, Shivajinagar, Pune, Maharashtra - 411005

ANUPAM RASAYAN INDIA LTD.
 Corporate Identification Number (CIN): L24231GJ2003PLC042988
 Registered Office: 8110, GIDC Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat, India. Tel. No.: +91-261-2398991-95; Fax: +91-261-2398996
 Email: office@anupamrasayan.com, Website: www.anupamrasayan.com

POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

Members of Anupam Rasayan India Limited ("the Company") are requested to note that pursuant to and in compliance of section 108 and section 110 of Companies Act, 2013 and all other applicable provisions of the Companies Act, 2013 ("the Act") read with rule 20 and rule 22 of Companies (Management & Administration) Rules, 2014 ("the rules") (including any statutory modifications or re-enactments) thereof for the time being in force) read with the General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020 and the General Circular No. 39/2020 dated December 31, 2020 and other relevant circulars and notifications issued by the Ministry of Corporate Affairs (hereinafter collectively referred to as "the MCA Circulars"), the Company has completed the dispatch of Postal Ballot Notice along with the notes and the explanatory statement on February 11, 2022 electronically to all those Members whose names appear on the Register of Members / List of Beneficial Owners as on February 10, 2022 ("Cut-off date") received from the Depositories and whose e-mail address are registered and available with the Company / Depositories, seeking approval of the Members in respect of the special resolution proposed under regulation 17(1A) of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements), Regulations, 2015, for continuation of directorship of Mr. Vijay Kumar Batra (DIN: 00038275) on the board of directors of the company, who shall attain the age of 75 years on March 13, 2022, by way of postal ballot through remote e-voting process only.

The Postal Ballot Notice ("Notice") is available on the website of the Company at www.anupamrasayan.com, the websites of the stock exchanges i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and the website of the National Securities Depository Limited (NSDL) <https://www.evoting.nsdl.com>.

Information on e-voting:
 In terms of the MCA Circulars read with the applicable provisions under the Act and rules made thereunder, Members can cast their votes through remote e-voting only. The Company has engaged NSDL for providing remote e-voting facility for this Postal Ballot. The Members whose name appear on the Register of Members / list of beneficial owners as on the Cut-off date only would be considered for the purpose of e-voting. A person who is not a Member as on the Cut-off date should treat this postal ballot notice for information purposes only. Voting rights of a member / beneficial owner shall be in proportion of his/her/its shareholding in paid-up equity capital of the Company as on the cut-off date. Once the vote on a resolution is cast by the member, he shall not be allowed to change it subsequently or cast the vote again. Members may cast their votes during the period mentioned hereinbelow:
Commencement of e-voting: 09:00 am (IST) on Saturday, February 12, 2022
Conclusion of e-voting: 05:00 pm (IST) on Sunday, March 13, 2022
 E-voting shall be disabled and shall not be allowed beyond 05:00 pm (IST) on Sunday, March 13, 2022. Postal ballot received / votes cast from the member beyond the said date will not be valid and voting by electronic means shall not be allowed beyond the said date. The results of e-voting shall be made available not later than Tuesday, March 15, 2022. The resolution as stated in the Notice, if approved by the Members with requisite majority shall be deemed to have been passed on Sunday, March 13, 2022. The results of the voting by means of postal ballot shall be made available at the website of the Company at www.anupamrasayan.com and on the website of NSDL at <https://www.evoting.nsdl.com>. The results shall be also communicated to the BSE and NSE, and the same shall be available on their respective websites.
 Detailed instructions and notes pertaining to process and manner of e-voting for the Members of the Company are provided in the Postal Ballot Notice. The process and manner of e-voting is also available on the website of the Company at www.anupamrasayan.com for reference purpose for the Members.
Manner of registering/updating e-mail address:
 Members are requested to note and follow the below steps for registering/updating their e-mail address for receiving the Postal Ballot Notice and remote e-voting.
 1. Members holding shares in dematerialised form as on cut-off date i.e. February 10, 2022 who are eligible to receive the postal ballot notice and cast their vote, and have not received the postal ballot notice are requested to contact their Depository Participants ("DPs") for registering their e-mail address and follow the process stipulated by DPs for registering e-mail address. Consequently to the registration/update of e-mail address after the Cut-off date with their DPs, Members are requested to communicate the same to the Company/RTA/NSDL by writing an e-mail to investors@anupamrasayan.com, einward.ns@kfintech.com and evoting@nsdl.co.in.
 2. In case of any queries/grievances, Members may refer the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members available at the download section of www.evoting.nsdl.com. Members, who need assistance for e-voting can contact NSDL official Ms Sarita Mote on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request at evoting@nsdl.co.in.

For Anupam Rasayan India Limited
 Sd/-
 Date: February 11, 2022
 Suchi Agarwal
 Place: Surat
 Company Secretary and Compliance Officer

METRO COMMERCIAL COMPANY LIMITED
 Regd. Office : B. R. Chandak Market, Marwari Pally, Ward No 6, Guwahati, Jorhat, AS-785001 IN
 Email : metrocommercialcompany@gmail.com, Website : www.metrocommercialcompany.com, CIN : L51109AS1985PLC002401

Extract of Statement of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter and nine months ended December 31, 2021

S. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended 31.12.2021	Nine Months ended 31.12.2021	Quarter ended 31.12.2020	Quarter ended 31.12.2021	Nine Months ended 31.12.2021	Nine Months ended 31.12.2020
		(Unaudited)	(Unaudited)	(unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operation (net)	2.16	8.71	1.73	2.16	8.71	
2	Net Profit / (Loss) for the quarter/year (before Tax, Exceptional and/or Extraordinary Items)	(0.38)	1.21	(1.17)	(0.38)	1.21	
3	Net Profit/(Loss) for the quarter/year before tax (after Exceptional and/or Extraordinary Items)	(0.38)	1.21	(1.17)	(0.38)	1.21	
4	Share of Profit from Associate & Joint Venture	-	-	-	(0.10)	0.06	
5	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(0.38)	1.21	(1.17)	(0.48)	1.27	
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.38)	1.21	(1.17)	(0.48)	1.27	
7	Equity Share Capital	100.00	100.00	100.00	100.00	100.00	
8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	
9	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) -						
	Basic :	(0.04)	0.12	(0.12)	(0.05)	0.13	
	Diluted :	(0.04)	0.12	(0.12)	(0.05)	0.13	

NOTES:
 a) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity www.metrocommercialcompany.com.
 b) In AS compliant Financial Results for the quarter and nine months ended December 31, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on 11/02/2022.

For and on behalf of the Board of Directors
 For METRO COMMERCIAL COMPANY LIMITED
 Vishal Kumar Sharma
 Wholetime Director
 DIN: 07310503

Date : 11.02.2022
 Place : Guwahati

PEE CEE COSMA SOPE LTD.
 CIN : L24241UP1986PLC008344,
 Regd. Office : Padampalaya, Hall No. H1-H2, First Floor, Plot No.5, Sector-16B
 Awasth Vikas Sikandra Yojna, Agra - 07 (U.P.), Tel. : 0562-2527330/31/32, Fax : 0562-2527329
 E-mail : pccosmailisting@doctorsoap.com Website : www.doctorsoap.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DEC 2021

Sl. No.	PARTICULARS	₹ in Lacs				
		Quarter Ended		Nine Month Ended		
		31.12.2021	30.09.2021	31.12.2020	31.12.2020	
		UNAUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	
1	Total Income from Operations	2282.18	2198.78	2004.10	6777.00	6350.29
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	12.81	92.45	166.33	209.91	563.15
3	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12.81	92.45	166.33	209.91	563.15
4	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	10.24	69.03	125.41	157.48	416.98
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	10.24	69.03	125.41	157.48	416.98
6	Paid-up Equity Share Capital (face value of Rs. 10/- each)	264.63	264.63	264.63	264.63	264.63
7	Earning per share (Quarterly not annualised)					
	Basic (Rs.)	0.40	2.60	4.70	6.00	15.80
	Diluted (Rs.)	0.40	2.60	4.70	6.00	15.80

Notes: (1) The above is an extract of the detailed format of Financial Results for Quarter and Nine months ended December 31, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the websites of Stock Exchange (www.bseindia.com) and the Company's website (www.doctorsoap.com). (2) The above Results were Reviewed and recommended by the Audit Committee & approved by the Board of Directors at their Meeting held on February 11, 2022. (3) An Independent Auditors Review Report as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed on detailed Unaudited Financial Results for the quarter and nine months ended December 31, 2021 filed with the Stock Exchanges. (4) Figures for the previous period have been regrouped wherever necessary, to conform to the current period's classification.

For & on behalf of the Board
PEE CEE COSMA SOPE LIMITED
 MAYANK JAIN
 (Executive Chairman)
 DIN : 00112947

PLACE : AGRA
 DATED : 11.02.2022

A TRUSTED NAME FOR MORE THAN 70 YEARS

GIVING CONTINUOUSLY TRUSTWORTHY RESULTS

HDFC MUTUAL FUND
 BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited
 A Joint Venture with abrdn Investment Management Limited
 CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 * Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676
 Fax: 022 22821144 * e-mail: hello@hdfcfund.com * Visit us at: www.hdfcfund.com

NOTICE

NOTICE is hereby given that HDFC Trustee Company Limited, Trustee of HDFC Mutual Fund ("the Fund"), has approved the following Distribution under Income Distribution cum Capital Withdrawal ("IDCW") in the following Scheme(s) / Plan(s) of the Fund and fixed **February 17, 2022** (or the immediately following Business Day, if that day is not a Business Day) as the Record Date for the same:

Name of the Scheme(s) / Plan(s) / Option(s)	Net Asset Value ("NAV") as on February 10, 2022 (₹ per unit)	Amount of Distribution ¹ (₹ per unit)	Face Value (₹ per unit)
HDFC Focused 30 Fund - Regular Plan - IDCW Option (Payout and Reinvestment)	19.421	2.00	10.00
HDFC Focused 30 Fund - Direct Plan - IDCW Option (Payout and Reinvestment)	22.473		
HDFC Capital Builder Value Fund - Regular Plan - IDCW Option (Payout and Reinvestment)	29.765	3.00	
HDFC Capital Builder Value Fund - Direct Plan - IDCW Option (Payout and Reinvestment)	33.871		

The distribution will be subject to the availability of distributable surplus on the Record Date and may be lower.

Pursuant to the Distribution, the NAV of the IDCW Option(s) of the above Scheme(s) would fall to the extent of such distribution and statutory levy, if any.

Amount will be paid, net of applicable tax deducted at source (TDS), to those Unit holders / Beneficial Owners whose names appear in the Register of Unit holders maintained by the Fund / Statements of Beneficial Ownership maintained by the Depositories, as applicable, under the IDCW Option(s) of the aforesaid Scheme(s) on the Record Date (including investors whose valid purchase / switch-in requests are received by the Fund and the funds are available for utilization before cut-off timings in respect of the aforesaid Scheme(s), on the Record date).

With regard to Unit holders who have opted for Reinvestment facility under the IDCW Option(s), the amount due (net of applicable TDS) will be reinvested, by allotting Units at the ex-Distribution NAV per Unit (adjusted for applicable stamp duty).

Unit holders are advised to opt for payout through electronic mode(s) at the earliest due to the inherent benefits of such mode(s) such as convenience of the credit of the distribution proceeds into their bank account directly as also avoiding loss of payment instruments in transit or fraudulent encashment. Please arrange to send us a copy of a cancelled cheque of your bank account to have the electronic payout mode enabled.

Intimation of any change of address / bank details should be immediately forwarded to the Investor Service Centres of the Fund (for units held in non-demat form) / Depository Participant (for units held in demat form).

In view of individual nature of tax consequences, each investor should seek appropriate advice.

For **HDFC Asset Management Company Limited**
 (Investment Manager to HDFC Mutual Fund)

Place : Mumbai
 Date : February 11, 2022
 Sd/-
 Authorized Signatory

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

CAREER POINT LIMITED

Registered Office: Village Tangori, Banur, Mohali, Punjab-140601-India
 Corporate Office: CP Tower-1, Road No.1, IPIA, Kota-324005 (Raj.)
 CIN: L80100P82000PLC054497 | Ph: 080-47250011 | website: www.cpl.in | E-mail: investors@cpl.in

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31 DECEMBER, 2021
 (₹ in Lakhs Except Per Share Data)

PARTICULARS	₹ in Lakhs Except Per Share Data		
	Quarter Ended (31/12/2021)	Corresponding Quarter Ended (31/12/2020)	Nine Month Ended (31/12/2021)
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total Income from Operations (net)	1,496.80	1,602.71	4,088.88
Net Profit from Ordinary Activities after tax before Minority Interest	701.13	881.76	1,911.08
Net Profit for the period after tax and Minority Interest	701.14	557.10	1,911.08
Paid-up Equity Share Capital (Face value of ₹ 10/- each)	1,819.29	1,819.29	1,819.29
Reserves excluding Revaluation Reserve (NIL) as per balance sheet of previous year	-	-	-
Earnings Per Share (EPS)			
a) Basic EPS	3.85	4.85	10.50
b) Diluted EPS	3.84	4.85	10.49

Notes:
 1. Summarised Unaudited Standalone Financial Results of the Company for the Quarter ended December 31, 2021 is as under:
 (₹ in Lakhs Except Per Share Data)

PARTICULARS	₹ in Lakhs Except Per Share Data		
	Quarter Ended (31/12/2021)	Corresponding Quarter Ended (31/12/2020)	Nine Month Ended (31/12/2021)
	(Unaudited)	(Unaudited)	(Unaudited)
Total Income from Operations (net)	1,096.81	544.27	2,315.99
Net Profit for the period after tax and Minority Interest	370.35	520.51	1,057.49
Paid-up Equity Share Capital (Face value of ₹ 10/- each)	1,819.29	1,819.29	1,819.29
Reserves excluding Revaluation Reserve (NIL) as per balance sheet of previous year	-	-	-
Earnings Per Share (EPS)			
a) Basic EPS	2.04	2.87	5.81
b) Diluted EPS	2.03	2.87	5.80

2. The unaudited consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and have been approved by the Board of Directors at their respective meetings held on 10th February, 2022. Limited review of these results has been carried out by the auditors.
 3. The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the Quarter ended December 31, 2021 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website i.e. www.cpl.in and Stock Exchange websites i.e. www.bseindia.com and www.nseindia.com.

BY ORDER OF THE BOARD OF DIRECTORS
 FOR CAREER POINT LIMITED
PRAMOD MAHESHWARI
 Chairman, Managing Director and CEO
 DIN-00185711

Place: Kota (Rajasthan)
 Date: February 10th, 2022

ANUPAM RASAYAN INDIA LTD.
 CIN - L24231GJ2003PLC042988
 Regd. office: Anupam Rasayan India Ltd. 8110, GIDC Industrial Estate, Sachin, Surat - 394230, Gujarat.
 Tel: +91 261 2398991-95, Website: www.anupamrasayan.com,
 Email: investors@anupamrasayan.com

1. Extract from the Unaudited Consolidated Financial Results of Anupam Rasayan India Ltd. for the quarter ended December 31, 2021
 Amount (INR) in million except earning per share

Particulars	Quarter ended				Half Year Ended		Year Ended
	31-Dec-21	30-Sep-21	31-Dec-20	31-Dec-21	31-Dec-20	31-Mar-21	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	
Total Revenue	2,711.22	2,551.62	1,895.62	7,642.52	5,631.61	8,373.21	
Net Profit / (Loss) (before Tax & Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03	
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	593.16	502.00	312.71	1,534.81	668.29	1,000.03	
Net Profit / (Loss) (after Tax & Exceptional items)	379.03	360.53	216.46	1,060.76	481.52	702.96	
Total Comprehensive Income	379.77	358.40	213.92	1,049.92	471.28	695.49	
Share Capital	999.22	999.22	862.07	999.22	862.07	999.22	
Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet	-	-	-	-	-	14,734.80	
Earnings Per Share Basic & Diluted (Face Value of Rs. 5/- each)							
(-) Basic EPS (Rs.)	3.79	3.61	2.65	10.62	6.04	8.56	
(-) Diluted EPS (Rs.)	3.78	3.59	2.65	10.57	6.04	8.56	

2. Extract from the Unaudited Standalone Financial Results of Anupam Rasayan India Ltd. for the quarter ended December 31, 2021
 (Rs. in millions except per share data)

Particulars	Quarter ended				Half Year Ended		Year
-------------	---------------	--	--	--	-----------------	--	------

